

કલમ-૪ (૧) (બી) (૧) સંસ્થાના કાર્યો અને ફરજોની વિગતો :–

સુરત મહાનગરપાલીકા સત્તા મંડળ સાથે સંયુક્ત છે.

કલમ-૪(૧) (બી) (૦૨) અધિકારી / કર્મચારીઓની હોદ્દાઈઠ ફરજ અંગેની ટુંકી વિગત

મધ્યસ્થ કચેરીમાં ફરજ બજાવતાં નીજા વર્ગના કર્મચારીઓની કામગીરીની વિગત

અ.નં.	કર્મચારીનો હોદ્દો		ફરજની ટુંકી વિગત
૧	આંક્ષિક સુપ્રિન્ટેન્ડન્ટશ્રી	૧.	મધ્યસ્થ કચેરીને લગતી મહત્વની ખાતાકીય કામગીરીનું સંચાલન કરવું.
		૨.	પ્રથમશ્રેષ્ઠી કલાર્ક સુધીના પગારના ઈજાફા મંજુર કરવા. તેમજ રજા મંજુર કરવી.
		૩.	ખાતાને લગતી પરચુરણ ખરીદી કરવા અંગેના રૂ. ૧૦૦૦/- સુધીના બીલો મંજુર કરવો.
		૪.	જાહેર સભ્યો, વેપારીઓ, ઈજારદારો, સરકારી અને અન્ય બીન સરકારી સંસ્થાઓ સાથે ખાતાકીય બાબતે પત્રવ્યવહાર કરવો.
		૫.	તાબા હેઠળના કર્મચારીઓના ખાનગી અહેવાલ તૈયાર કરવા અંગેની કામગીરી.
		૬.	રૂ. ૫૦,૦૦૦/- સુધીના જનરલ એડવાન્સ ખાતે ઉપાડેલ રકમનું રીકુપમેન્ટ મંજુર કરવા અંગેની કામગીરી તથા ખાતાના પગારના બીલો / ટી.એ.ડી.એ. ના બીલો / એલ.ટી.સી. ના બીલો મંજુર કરવા અંગેની કામગીરી.
		૭.	ડીઝાસ્ટર મેનેજમેન્ટની કામગીરી.
		૮.	ડી.પી. આર્ડરની કામગીરી
		૯.	બોર્ડ / સ્ટેન્ડીંગ મીટિંગમાં હાજર રહેવું.
૨	સેક્શન ઓફિસર	૧	ફલેગ ડે નિમિત્તે અન્ય ખાતામાંથી નિયત રકમ એકત્ર કરી જિલ્લા સૈનિક કચેરીમાં જમા કરાવવાની કામગીરી.
		૨	જનરલ એડવાન્સ, એસ.ડી./ઈ.એમ.ડી. તથા ટી.એ.ડી.એ. નું રજી., નિભાવણીની કામગીરીની દેખરેખ કરવી.
		૩	વહીવટી અહેવાલ તૈયાર કરવો તથા છપાવવો તથા ઓડીટ અહેવાલની કામગીરી.
		૪	એસ્ટાફ્લીશમેન્ટ તથા પ્રોસ્ટીક્યુશનની કામગીરી.
		૫	પ્રથમ શ્રેષ્ઠી કલાર્ક સુધીના કર્મચારીની રજા તથા ઈજાફા મંજુર કરવાની કામગીરી.
		૬	વિવિધ ખાતા / જોનની રોજબરોજની ફેન્ડીંગ ટપાલો ફેન્ક કરવા અંગેની કામગીરી તથા તે સંલગ્ન ફેન્ડીંગ મશીન ઉત્પાદક કંપની તથા પોસ્ટ ખાતા સાથે જરૂરી પત્રવ્યવહાર કામગીરી.
		૭	રેકડની જાળવણી તથા વર્ગીકરણની કામગીરી.
		૮	સેક્શન ઓફિસરશ્રીની સત્તામાં આવતા બીલો મંજુર કરવાની કામગીરી.
		૯	જાહેર જનતાની અરજીઓ અંગે સંબંધિત ખાતા તેમજ જોન વાઈઝ શેરા મારવા.
		૧૦	તાબા હેઠળના પ્રથમ શ્રેષ્ઠી કલાર્ક, સીનીયર કલાર્ક તેમજ ટ્રીજી શ્રેષ્ઠી કલાર્કની કામગીરી પર દેખરેખ તથા જરૂર જણાયે કામગીરીની વહેચણની વ્યવસ્થા કરવી.
		૧૧	મે. ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટશ્રી દ્વારા સુચયવામાં / સૌંપવામાં આવતી કામગીરી.
૩	હેડ કલાર્ક	૧	ટયુશન ફી ચૂકવવાની કામગીરી, ડીઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ પ્રિપેરનેશ પ્લાનને લગતી કામગીરી, નાગરિક અધિકાર પત્ર તૈયાર કરવાની કામગીરી, સેન્ટ્રલ કંટ્રોલ રૂમ, સરકારશ્રી તરફથી માંગવામાં આવતી માહિતીનું સંકલન.
		૨	ક્રમિશનરશ્રીના પરિપત્ર મુજબ જુદા જુદા ખાતામાંથી મંજુરી અર્થે રજુ કરવામાં આવતી દરખાસ્તનો એકત્રિત રીપોર્ટ તૈયાર કરી સેક્ટેટરી વિભાગમાં મોકલવા અંગેની કામગીરી તથા સેક્શન ઓફિસરશ્રીની રજા દરમ્યાન તેમની તમામ કામગીરી સંભાળવી તેમજ તાબા હેઠળના સીની.કલાર્ક તેમજ ટ્રીજીશ્રેષ્ઠી કલાર્કની કામગીરી ઉપર દેખરેખ તથા જરૂર જણાયે કામગીરીની વહેચણી / વ્યવસ્થા કરવી.
		૩	આર.ટી.આઈ. ની કામગીરી.
		૪	હાજરીપત્રકની કામગીરી.
		૫.	મીનીટસની કાર્યવાહી કરવી.
૪	સીની. કલાર્ક	૧	સામાન્ય સભામાં સભ્યશ્રીઓ તરફથી પુછવામાં આવતા પ્રશ્નો અંગે તથા સુચનો અંગે સંબંધિત ખાતામાંથી જવાબ મેળવી શાઈલ તૈયાર કરવાની કામગીરી.
		૨	સ્થાયી સમિતિની મીટીંગ દરમ્યાન રજુ થતા સુચનો અંગે સંબંધિત ખાતા પાસેથી કોમ્પ્લાયન્સ રીપોર્ટ મેળવવાની કામગીરી.
		૩	ક્રમિ.શ્રી તરફથી હેલ્પ એન્જી., અંગે લેવામાં આવતી મીટીંગો તથા અન્ય મીટીંગોની કાર્યવાહીની નોંધ તૈયાર કરવાની કામગીરી.
		૪	ટ્રીજી શ્રેષ્ઠી કલાર્કની કામગીરી પર દેખરેખ તથા જરૂર જણાયે કામગીરીની વહેચણી / વ્યવસ્થા કરવી.
		૫	મધ્યસ્થ કચેરીમાં ફાળવવામાં આવેલ તમામ કોમ્પ્લાયન્સ સીસ્ટમની જાળવણી, ૨જીસ્ટર, નિભાવવા અંગેની કામગીરી.
		૬	સુ.મ.પા. ના બજેટ બોર્ડમાં રજુ થતા સુચનો / રજુઆતો અંગેની નોંધ તૈયાર કરવા અંગેની કામગીરી.

		૭	એસ્ટાબ્લીશમેન્ટ તથા પ્રોસીક્યુસન કામગીરી.
		૮	સુ.મ.પા. ભરતી અંગેની જાહેરાત સમયે અરજીઓની સ્વીકૃતિ તેમજ એસ.ઓ.(આર)શ્રી ને પહોંચાડવા અંગેની તમામ આનુસંગિક વ્યવસ્થા કરવી.
		૯	પર્સનલ એડવાન્સ, ટી.એ.ડી.એ. ૨જીસ્ટર નિભાવવાની કામગીરી, જનરલ એડવાન્સ, એસ.ડી. / ઈ.એમ.ડી. સંલગ્ન તમામ કાર્યવાહી તેમજ તે સંલગ્ન જરૂરી ૨જીસ્ટર નિભાવવાની કામગીરી.
		૧૦	ખ્રુ. સભ્યશ્રીઓના ગ્રાન્ટ તથા અન્યો પત્રો નોંધવાની કામગીરી.
		૧૧	પ્રતિ વર્ષ વહીવટી અહેવાલ, ઓડીટ અહેવાલ છપામણી તેમજ પ્રસિદ્ધ કરવા સીની. કલાક સાથે સંકલનમાં રહી તમામ આનુસંગિક કાર્યવાહી પુર્ણ કરી તૈયાર કરવાની કામગીરી.
		૧૨	નાગરીક આધિકારપત્ર અન્વયેની મળતી અરજીઓ તથા તેના નિકાલ અંગેની ખાતા / જોનની માહિતી એકત્રિત કરી સરકારશ્રીમાં મોકલવાની કામગીરી.
		૧૩	સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓના બાળકોની ટયુશન ફી / સત્ર ફી રીઈમબ્સ ની કામગીરી તથા ૭૩-ડી અન્વયે જોન / ખાતામાંથી આવતી વિગતોએ જરૂરી વિવિધ સમિતિ વાઈજ સંકલિત કરી દરખાસ્ત તૈયાર કરી સેકેટરી વિભાગમાં મોકલવા અંગેની કામગીરી.
		૧૪	પર્સનલ એડવાન્સ, ટી.એ.ડી.એ. ૨જીસ્ટર નિભાવવાની કામગીરી, જનરલ એડવાન્સ, એસ.ડી., ઈ.એમ.ડી. ૨જીસ્ટર નિભાવવાની કામગીરી, વહીવટી અહેવાલ તૈયાર કરવો તથા છપાવવો તથા ઓડીટ અહેવાલની કામગીરી તેમજ ખ્રુ. સભ્યશ્રીઓના ગ્રાન્ટ તથા અન્ય પત્રો નોંધવાની કામગીરી. તેમજ આર.ટી.આઈ. ની કામગીરી કરવી. (APIO) સીની.કલાકને મદદ કરવી.
		૧૫	પ્રતિ વર્ષ ફ્લેગ ડે ઉજવણી અન્ય જોન / ખાતામાંથી લક્ષ્યાંક મુજબની રકમ એકત્ર કરી કલેક્ટર ઓફિસમાં જમા કરાવવા અંગેની કામગીરી.સીની.કલાકને મદદ કરવી.
		૧૬	ક્રમિશનરશ્રીના પરિપત્ર મુજબ જુદા જુદા ખાતામાંથી મંજુરી અર્થે ૨જુ કરવામાં આવતી દરખાસ્તો એકત્રિત કરી રીપોર્ટ તૈયાર કરી સેકેટરી વિભાગમાં મોકલવાની કામગીરી.
		૧૭	વિવિધ જોન / ખાતામાંથી સેકેટરીશી પ્રતિ મોકલવામાં આવતી દરખાસ્તો ફાઈલ સહી કરાવી નોંધ અનુસાર નોંધ કરી અન્તેથી ખાતામાં મોકલવાની તથા સમિતિવાઈજ મીટિંગમાં સેકેટરીમાંથી અન્તે સંબંધિત ખાતા / જોનમાં મોકલવાની કામગીરી.
		૧૮	સ્થાયી સમિતિની મીટિંગ સંલગ્ન ઐજન્ડા સહિતની મીટિંગ ફાઈલ તૈયાર કરવાની કામગીરી.
		૧૯	ફેક્સ કરવા તથા મોકલવા અંગેની કામગીરી.
		૨૦	સરકારી / અર્ધસરકારી વિગેરે આવતા પત્રો ૨જીસ્ટરમાં નોંધ કરવાની કામગીરી તથા જાહેર જનતા તરફથી આવતા પત્રો / ફ્રીયાદની નોંધણી કરવાની કામગીરી.
		૨૧	મે. કમિ.શ્રીમાં જુદા જુદા ખાતા ધ્વારા મુકવામાં આવતા બાઈન્ડરોની નોંધણી તેમજ સહી થઈને આવતા બાન્ડરો જુદા જુદા વિભાગોમાં પરત મોકલવાની કામગીરી.
		૨૨	જરૂરીયાત મુજબની જરૂરી સ્ટેશનની તથા ઓફિસ સામગ્રીની ખરીદી.
૫	ગીજી શ્રેષ્ઠી કલાક	૧	મેયર્સ ફંડ અંગેના પત્રવ્યવહાર
		૨	ફેન્કીંગ મશીન, ફેક્સ મશીન તથા જેરોક્ષ મશીનોનો વાર્ષિક કોન્ટ્રાક્ટ રેઇટથી કરવા તથા રીપેરીંગ કરાવવા અંગેની કામગીરી.
		૩	પ્રિ-મોન્સુન કામગીરી અંતર્ગત સ્વેચ્છિક સંસ્થાઓની અધ્યાવત યાદી તૈયાર કરવાની કામગીરી તથા સ્વેચ્છિક સંસ્થાઓ સાથે મીટિંગ યોજવા અંગેની તમામ આનુસંગિક કાર્યવાહી.
		૪	ડેડ સ્ટોક ૨જીસ્ટર નિભાવણી અંગેની કામગીરી.
		૫	મધ્યસ્થ કયેરીના તમામ પત્રો વિગેરે ટાઈપ અંગેની કામગીરી તેમજ ઓફિસ સુપ્રિ.શ્રી તરફથી સૌંપવામાં આવતી કામગીરી.
		૬	વિવિધ ખાતા / જોની રોજબરોજ ફેન્કીંગની ટપાલો ફેન્ક કરવા અંગેની કામગીરી તથા તે સંલગ્ન ફેન્કીંગ મશીન ઉત્પાદક કંપની તથા પોસ્ટ ખાતા સાથેના જરૂરી પત્ર વ્યવહારની કામગીરી.
		૭	૨૬ મી જાન્યુઆરીના ૧૫ મી ઓગષ્ટના ઉજવણી અંગેનો જરૂરી સુચનાઓ જારી કરતો પરિપત્ર જારી કરાવવા અંગેની કામગીરી.
		૮	મધ્યસ્થ ફલડ કંટ્રોલ રૂમ શરૂ કરવા અંગેની કામગીરી તથા તે સંબંધિત જરૂરી હુકમ જારી કરવા, પ્રિ-મોન્સુન પ્રતિવર્ષ ડી.એમ.પી. પુસ્તકા તૈયાર કરી પ્રસિદ્ધ કરવાની કામગીરી.
		૯	કર્મચારીઓના બાળકોના વિવિધ સ્કોલરશીપ અનેનાયત કરવા અંગેની કામગીરી.
		૧૦	સરકારશ્રીમાંથી આવતા પત્રો સરકારશ્રીમાં મોકલવાની માહિતી વિગતો સંદર્ભે ખાતા / જોન સંકલનની કામગીરી તથા પત્ર વ્યવહારની કામગીરી.

		૧૧	વિશીષ કામગીરી તથા પ્રસંશાપત્રો એનાયત કરવાની આનુષાંગિક કામગીરી.
		૧૨	મેયરશ્રી, ડે. મેયરશ્રી, સ્થાયી સમિતિના અધ્યક્ષશ્રી, વિવિધ સમિતિઓના સદસ્યશ્રી, ઓડીટરશ્રીના પત્રો, કોર્ટ સમન્સ, વિભાગીય વડાશ્રીઓ તરફથી મોકલવામાં આવતા પત્રો / નોંધ સંલગ્ન કામગીરી.
		૧૩	પોલીસી મેટરને લગતી જે તે વિભાગોની ફાઈલ તૈયાર કરવી તથા જાળવવી તથા રજીસ્ટર નિભાવવાની કામગીરી.
		૧૪	ડી.પી. ઓર્ડરની ફાઈલોની જાળવણી તથા રજીસ્ટર નિભાવવાની કામગીરી.
		૧૫	મેયરશ્રી, ડે. મેયરશ્રી, સ્થાયી સમિતિના અધ્યક્ષશ્રી, વિવિધ સમિતિઓના સદસ્યશ્રી, ઓડીટરશ્રીના પત્રો, કોર્ટ સમન્સ, વિભાગીય વડાશ્રીઓ તરફથી મોકલવામાં આવતા પત્રો / નોંધ રજીસ્ટરમાં નોંધ કરી તે સંલગ્ન કામગીરી.
		૧૬	તમામ જોન / તથા (સેન્ટ્રલ જોન) સીવાય મ.ધ.હો., સ્મીમેર કોલેજ અને હોસ્પિટલ, સ્લમ અપગ્રેડેશન સેલ, રૂનેજ ખાતુ, તથા ટ્રાફિક સેલની અન્ય ખાતા જોનની ટપાલો સ્વીકારી જરૂરી નોંધ રજીસ્ટરમાં નોંધ કરી જે તે દિવસે સંબંધિત ખાતા / જોનમાં મોકલવાની કામગીરી.
		૧૭	જી તથા જી-૧ રજીસ્ટર (સરકારશ્રી તરફથી તેમજ અન્ય સરકારી ખાતામાંથી પત્રો) ની નોંધણી કરી સંબંધિત ખાતા / જોનને તેમજ જાહેર જનતા ધ્વારા કમિશનરશ્રીને ઉદ્દેશીને આવતા પત્રો / ફરીયાદની જરૂરી નોંધણી કરવાની તેમજ સંબંધિત ખાતા / જોનને મોકલવાની કામગીરી.
		૧૮	એસ્ટઝ્લીશમેન્ટ, પ્રોસીક્યુશનને લગતી તમામ આનુષાંગિક કામગીરી.
		૧૯	ડી-રજીસ્ટર (જાહેર જનતામાંથી આવતી ટપાલો) સી.એચ. રજીસ્ટર (હાઈકોર્ટ મેટર, ડી.એફ. રજીસ્ટર) તથા જુદી જુદી જગ્યાઓ ભરવા માટે આવતી અરજીઓની નોંધ રજીસ્ટરમાં જરૂરી નોંધણી કરી એસ.એ.શ્રી (આર) માં નિયત સમયે પહોંચતી કરવી.
		૨૦.	વખતો વખત ઓ.એસ.શ્રી તથા એસ.એ.શ્રી ધ્વારા આપવામાં આવતી કામગીરી હાથ ધરવી.
		૨૧.	તમામ વિભગીય વડાશ્રીઓની ઓફિસમાં ઉપયોગમાં આવતી સ્ટેશનરીની ફાળવણી કરવી.
		૨૨.	સેન્ટ્રલ સ્ટોર તથા આઇ.એસ.ડી. વિભાગમાં ઈન્ડોર ભરી સ્ટેશનરી મેળવી તથા તની જાળવણી તથા મેઈન્ટેન કરવાની કામગીરી.

કલમ-૪(૧) (બી) (૦૨) અધિકારી / કર્મચારીઓની હોદ્દાઈઠ ફરજ અંગેની ટુંકી વિગત

કમ્પેન્ચ મેનેજમેન્ટ એન્ડ એનાલીસીસ સેલમાં ફરજ બજાવતાં ત્રીજા વર્ગના કર્મચારીઓની કામગીરીની વિગત

અ.નં.	કર્મચારીનો હોદ્દો		ફરજની ટુંકી વિગત
૧	ઓફિસ સુપ્રિન્ટન્ડન્ટશ્રી	૧.	કમ્પેન્ચ મેનેજમેન્ટ એન્ડ એનાલીસીસ સેલની ને લગતી મહત્વની કામગીરીનું સંચાલન કરવું.
		૨.	ખાતામાં ફરજ બજાવતા પ્રથમ શ્રેણી કલાર્ક સુધીના પગારના ઈજાફા મંજુર કરવા.
		૩.	ખાતાને લગતી પરચુરણ ખરીદી કરવા અંગેના રૂ. ૧૦૦૦/- સુધીના બીલો મંજુર કરવા.
		૪.	જાહેર જનતા અને અન્ય ખાતા વિભાગ/ઝોન સાથેના કમ્પેન્ચ તેને સંબંધિત બાબતે પત્રવ્યાપવાર કરવો.
		૫.	તાબા હેઠળના કર્મચારીઓના ખાનગી અહેવાલ તૈયાર કરવા અંગેની કામગીરી.
૨	પ્રથમ શ્રેણી કલાર્ક	૧	તા.કલાર્ક, પટાવાળા તેમજ બેલદાર સુધીની કર્મચારીની રજા ખતવણી કરવાની કામગીરી.
		૨	જુદા જુદા ખાતા/ઝોનમાં કમ્પેન્ચ કેટેગરી અને સબ કેટેગરી મુજબ ઝોન/વિભાગ માંથી મોકલવામાં આવતી એસાઈની ઓફિસરોના નામ અને મોબાઇલ નંબર ની વિગતો કમ્પેન્ચ મેનેજમેન્ટ સીસ્ટમમાં અપડેટ કરવી..
		૩	દરેક નાણાકીય વર્ષ ને અંતે ખાતાનો વહીવટી અહેવાલ તૈયાર કરવો.
		૪	રેકડની જાળવણી તથા વર્ગીકરણની કામગીરી.
		૫	તાબા હેઠળના સીનીયર કલાર્ક તેમજ તા.કલાર્ક ની કામગીરી પર દેખરેખ તથા જરૂર જણાયે કામગીરી વહેચણી વ્યવસ્થા કરવી.
		૬	આર.ડી.આઈ. ની કામગીરી.
		૭	મે. ઓફિસ સુપ્રિન્ટન્ડન્ટશ્રી ધ્વારા સુચયવામાં / સાંપવામાં આવતી કામગીરી.
		૮	જે એસાઈની ઓફિસરની ફરિયાદ વધારે સંઘાં હોય તેમજ એક માસ થી વધુ સમય દરમાન પડતર હોય તેમને નિકાલ કરવા માટે ટેલીફોન મારકત જાપણ કરવાની કામગીરી.
૩	સીની. કલાર્ક	૧	કમ્પેન્ચ મેનેજમેન્ટ સીસ્ટમમાં જાહેર જનતા તરફથી ડેલ્પલાઈન/કોલ સેન્ટર પર, વોટ્સ એપ મારકત, વેબ સાઈટ મારકત તેમજ મોબાઇલ એપ્લિકેશન મારકત કરવામાં આવતી અધરની કેટેગરીની ફરિયાદ સંબંધિત ઝોન/ખાતા પ્રતિ તબદીલ કરવામાંની કામગીરી.
		૨	આર.ડી.આઈ. ની કામગીરી.
		૩	ગીજી શ્રેણી કલાર્કની કામગીરી પર દેખરેખ તથા જરૂર જણાયે કામગીરીની વહેચણી / વ્યવસ્થા કરવી.
૪	ત્રીજી શ્રેણી કલાર્ક	૧	સુરત મહાનગરપાલિકાના કોલ સેન્ટર/ટોલ ફી નંબર તેમજ વોટ્સ એપ નંબર પર જાહેર જનતા મારકત કરવામાં કમ્પેન્ચ મેનેજમેન્ટ સીસ્ટમમાં ઇનપુટ કરીને કમ્પેન્ચ આઈ.ડી.નંબર SMS મારકત મોકલવાની કામગીરી.
		૨	કમ્પેન્ચ મેનેજમેન્ટ સીસ્ટમ ના તમામ પત્રો વિગેરે ટાઈપ અંગેની કામગીરી તેમજ ઓફિસ સુપ્રિ.શ્રી, પ્રથમ શ્રેણી કલાર્ક તેમજ સીની.કલાર્ક તરફથી સાંપવામાં આવતી કામગીરી. અન્ય ખાતા ઝોનની ટપાલો સ્વીકારી જરૂરી નોંધ રજીસ્ટરમાં નોંધ કરી જે તે ટિવસે સંબંધિત ખાતા / ઝોનમાં મોકલવાની કામગીરી.
		૩	ઇનવર્ડ અને આઉટવર્ડ રજીસ્ટર નિભાવવા અને ટપાલ સંબંધિત ખાતા/ઝોન પ્રતિ મોકલવાની કામગીરી. અન્ય ખાતા ઝોનની ટપાલો સ્વીકારી જરૂરી નોંધ રજીસ્ટરમાં નોંધ કરી જે તે ટિવસે સંબંધિત ખાતા / ઝોનમાં મોકલવાની કામગીરી.

મધ્યસ્થ કુચેરી વર્ષ-૨૦૨૩

અધિકારી/કર્મચારીઓની માહિતી દર્શાવતું પત્રક તા. ૩૧/૦૩/૨૦૨૩

અ.નં.	અધિકારી/કર્મચારીનું નામ તથા કર્મચારી નંબર	હોંડો	સરનામું તથા ફોન નંબર/મોબાઈલ નંબર	રિમાર્ક્સ
1	શ્રી જવેરભાઈ સી.પટેલ- ૩૪૦૪૨	પ્રિ.પ્રા.સેકેટરી	૭ નેસ્ટ વેનેજીઆ, કેનાલ રોડ, અલથાણ જી.સુરત-૩૮૫૦૧૭, મો.૯૭૨૪૩ ૪૫૫૫૪	
2	શ્રી પ્રવીષુકુમાર.આર.પ્રસાદ- ૩૪૬૭૫૪	એક્ઝી આસી.	૨૦૧-બી, ૧૬/૨, શ્રીનસીટી, પાલભાઈ રોડ, સુરત - ૩૮૭૪૧૫, મો.૯૭૨૪૩ ૪૫૪૬૩	
3	શ્રી મેહુલકુમાર એસ.પટેલ- ૩૬૨૪૮	એક્ઝી.આસી.	૨૮/બી, કિશ્ચાનગર સોસાયટી-૨, ગુજરાત ગેસ સર્કલ પાસે, રંદેરરોડ, સુરત, મો.૯૭૨૪૩ ૪૫૪૬૮	
4	શ્રી હેમાંગીનીબહેન કે. ચૌહાણ- ૩૭૪૬૦	આસી.ઇઝનેર	૧૪૪, સંધ્યાવંદન સોસાયટી, પાલનપુર પાટીયા, મીની વીરપુર રોડ, સુરત-૩૮૫૦૦૮, મો.૯૬૬૪૪૭૮૮૮ ૪૦૩૧૪	
5	શ્રીવિક્રમ સી. ચૌધરી-૩૭૫૬૩	આસી.ઇઝનેર	૧૦૧-પહેલો માળ, પ્લોટ નં. ૭૧-૭૨, કૃષ્ણાંજ એપા., સર્વોદય નગર, ઉધના, સુરત મો.૭૮૭૪૫ ૮૦૬૧૧	
6	શ્રી હેમાંગીની પી. ઠાકોર- ૧૦૮૧૨	ઓ.એસ.	એ ૨૦૩, અશ્વ હોમ્સ, ભાગ્યલક્ષ્મી સોસા.ની સામે, મધુરમ ડેરીની સામે, પીપલોં, સુરત-૩૮૫૦૦૩ મો- ૮૧૪૧૯ ૧૨૭૦૭, ૮૮૨૫૨ ૪૦૩૧૪	
7	શ્રી યુ.એમ.જાદવ-૧૧૬૩૨	એસ.ઓ.	૬૩, હરસિદ્ધ સોસાયટી, જૂનો કોસાડ રોડ, અમરોલી, સુરત. મો.૯૮૮૨૫૧ ૫૫૧૦૪	
8	શ્રી ફાલ્ગુનીબેન આર. મેહતા- ૧૨૪૭૦	હેડ કલાર્ક	એ-૧૦૨ સુમેર રેસીડન્સી, અડાજણા, પાલ, મણીભદ્ર રેસીડન્સીની બાજુમાં, સુરત મો.૮૮૪૬૧ ૦૭૬૩૨	
9	શ્રી અલ્પેશકુમાર પી.ચૌહાણ- ૪૨૨૪૫	સ્ટે.-II	૨, શાંતિવન રો હાઉસ, ગેંદલ ટાવરની સામે, આનંદ મહલ રોડ, અડાજણા, સુરત. મો. ૯૯૨૪૬ ૧૫૭૪૫, ૭૨૨૮૦ ૨૦૪૩૨	
10	શ્રીમતી તેજલબેન આર.સારંગ- ૪૨૨૫૦	સ્ટે.-II	૧/૭૫૮, જૂની પારસી ધર્મશાળાની પાછળ, ખારવાડ, નાનપુરા, સુરત. મો.૮૮૨૦૧ ૫૪૧૨૬	
11	શ્રી પ્રમોદ આર. બોરસે- ૧૦૮૮૩	સીની. કલાર્ક	૧૨૨-મારૂતિધામ સોસા., જૂનો કોસાડ રોડ, રેલ્વે લાઈન, અમરોલી, સુરત-૩૮૪૧૦૭ મો.૯૮૮૨૪૩ ૮૪૫૧૪	
12	શ્રી મો.ફેયાજ એ.ગાડીવાલા- ૩૫૧૬૩	સીની કલાર્ક	પ્લોટ નં. ૧૧, અમન સોસાયટી વિભાગ-૩, જીવન જ્યોત સિનેમાની પાછળ, સુરત. મો.૯૮૮૨૪૭ ૩૨૩૭૭	
13	શ્રી નિમેષ જી.નાયક-૩૬૪૦૭	સીની કલાર્ક	૧૧૧, વિશાલ કો-ઓપ, હાઉસિંગ સોસા, ભટાર ચાર રસ્તા પાસે, ઉધના- મગદલા રોડ, ભટાર, સુરત- ૩૮૫૦૦૧, મો.૯૮૮૮૭ ૧૬૬૮૭	
14	શ્રી ગુણવંતભાઈ જે. પટેલ- ૩૬૪૧૦	સીની કલાર્ક	૬, જલારામ નગર, કરંજ રોડ, તા. એલપાડ જી.સુરત. - ૩૮૪૫૪૦ , મો.૯૮૮૨૫૭ ૭૨૫૨૩	
15	શ્રી રાકેશકુમાર.એસ. મહાગાંવકર - ૪૨૮૮૫	સીની કલાર્ક	૧૬, મુલાનંદનગર, ઘેલખડી રોડ, નવસારી - ૩૮૬૪૪૫ મો.૮૮૩૭૪૫ ૧૧૮૭૬	
16	શ્રી ધશવંતભાઈ.આર.સોલંકી- ૧૯૧૮૦	કલાર્ક-III	મુ. પો:વેલંજા, પ્રાથમિક શાળાની બાજુમાં, તા. કામરેજ, જી.સુરત-૩૮૪૧૫૦ મો.૮૮૨૦૫ ૬૧૮૮૮	
17	શ્રી ધનેશ એમ.ચૌહાણ-૪૩૧૮૨	કલાર્ક-III	૦૫, તપસ નગર સોસાયટી, મીની વીરપુર મંદિર પાસે, પાલનપુર નહેર રોડ, સુરત. મો.૯૯૧૩૩ ૨૨૫૫૫	

18	શ્રી વિમલકુમાર બી.પટેલ- ૪૭૩૮૫	કલાક્-III	૧૪૩, રાધેપાર્ક સુભાષ ગાર્ડન પાસે, દાંડી રોડ, રાંદેર, સુરત. મો. ૯૮૭૯૮૦ ૨૭૪૦૦	
19	શ્રી ધવલકુમાર સી.જરીવાળા- ૪૭૩૮૫	કલાક્-III	૮/૧૬૭-બી.ચક્રવાલા ની શેરી, વાડીકણીયા, સુરત-૪૭૫૦૦૩ મો. ૮૧૪૦૨ ૦૨૦૬૭	
20	શ્રી મો.સોહેલ બી.મીરજા- ૪૭૩૮૬	કલાક્-III	૧૨/૧૫૭૮, ૨૦૨, હિદાયત પેલેસ, પટની હોલની સામે, ખાહમપોળ, શાહપોર, સુરત-૪૭૫૦૦૩ મો. ૮૭૫૮૨ ૬૫૩૪૪	
21	શ્રી દિપીકા ડી.પટેલ-૪૭૩૮૭	કલાક્-III	૧૦૫/બી.ઈચાનગર સોસાયટી, જહાંગીરપુરા, સુરત. મો. ૮૭૨૪૮ ૬૪૫૮૭	
22	શ્રી પ્રિતેશકુમાર બી.દરજી- ૪૭૩૮૮	કલાક્-III	૭૭, હરીનગર-૩, બી.આર.સી.ગેટની સામે, ઉંઘના - સુરત. મો. ૯૮૭૯૮૮ ૨૫૮૮૭	
23	શ્રી ઘ્યાતિ એસ.સુરતી- ૪૭૩૮૯	કલાક્-III	અ/૭, મહાવીર રોડ હાઉસ, હનીપાર્ક રોડ, અડાજાણા, સુરત, મો. ૯૮૨૪૦ ૪૧૭૧૧	
24	શ્રી ભૂમિ એન.ચૌહાણ-૪૭૩૮૦	કલાક્-III	૦૭, વિશ્વકર્મા સોસાયટી, રામનગર, રાંદેરરોડ, સુરત. મો. ૯૭૨૭૦ ૫૭૪૭૮	
25	શ્રી ભાવિનીબહેન એચ.ગાંધી- ૪૭૩૮૧	કલાક્-III	૫૦, પુનિતનગર સોસાયટી, વિજયડેરી નજીક, પાલનપુર પાટિયા, સુરત, મો. ૯૦૩૭૮ ૪૫૬૪૮	
26	શ્રી હર્ષ બી.શેઠ-૪૭૩૮૨	કલાક્-III	૭-૪૦૨, ગ્રીન એન્ક્લેવ એપાર્ટમેન્ટ, સરદારપુરની નજીક, અડાજાણા, સુરત, મો. ૯૮૭૯૮૪ ૪૫૬૧૩	
27	શ્રી મનીષ ડી.પટેલ-૪૭૬૫૭	કલાક્-III	૨૬૮, ઓમ બંગલોઝ, માસ્ટરની વાડી, અમરોલી રોડ, સુરત.-૪૭૫૦૦૫ મો. ૯૮૨૪૭ ૨૬૭૬૭	
28	શ્રી યોગિનીબેન સી.ઢીમર- ૪૭૭૯૧	કલાક્-III	૫૦-૩૫૮ સોસાયટી, મરાઠી સ્કુલ પાસે, વેડરોડ, સુરત-મો. ૮૪૬૦૬ ૫૭૧૭૪	
29	શ્રી અમીત જી.સોલંકી- ૪૭૭૯૩	કલાક્-III	સી-૩૦૨, શ્રીપદ સીજિન્સ, ન્યૂ ગૈરવપથ રોડ, પાલનપુર, સુરત-૪૭૫૦૦૮ મો. ૭૦૪૩૫ ૫૮૮૮૪	
30	શ્રી ભાવનાબહેન એન. માર્ટીન- ૪૭૯૨૧	કલાક્-III	૭૩૦૪, વનીતા પાર્ક એપાર્ટ. આશીવાદ પેલેસ ની પાછળ, ભટાર રોડ, સુરત. ૪૭૫૦૧૭ મો.- ૮૪૬૯૮ ૬૪૦૧૦	
31	શ્રી નિકિતાબેન આર.પટેલ- ૪૮૦૬૦	કલાક્-III	નગરશેઠની વાડી, મોરાભાગળ ચાર રસ્તા, રાંદેર, સુરત. ૮૨૨૩૮૮૦૬૪૬૪	
32	શ્રી અંજનાબેન એ.પટેલ- ૪૮૦૬૧	કલાક્-III	એ/૪૦, ન્યૂ સૌરભ સોસાયટી, એચ.પી. પેટ્રોલપની સામે, મોરાભાગળ, રાંદેર, સુરત. મો. ૯૭૨૪૨ ૭૩૩૭૫	
33	શ્રી હાર્દિક સુકેશકુમાર ભજી- ૪૮૦૬૨	કલાક્-III	એક્સ/૪૦૩, રાજહંસરેસીડન્સી, સુભાષ ગાર્ડની પાછળ, જહાંગીરપુરા, સુરત. મો. ૯૫૫૮૮૦૬૭૧૩	
34	શ્રી સનિલ નરેશભાઈ કાનફટે- ૪૮૦૬૩	કલાક્-III	૫૮૦, જલારામનગર સોસાયટી, ગણેશપુરા, અમરોલી, સુરત. ૮૧૪૧૬ ૩૬૩૫૫	
35	શ્રી જયેશકુમાર એમ.મકવાળા- ૪૮૦૬૪	કલાક્-III	એ-૬, પહેલો માળ, સરસ્વતી સોસા, ગેટ નં. ૧, શારદા વિદ્યાલયની સામે, કોઝી, સીગણાપોર-૪૭૫૦૦૪ મો. ૯૪૨૬૦ ૩૨૩૬૪	
36	શ્રી સાગર એ.ઢીમર-૪૮૬૯૮	કલાક્-III	૧૨/૨૩૩૩, માણીવાડ, સૈયદપુરા, સુરત. મો. ૭૩૮૩૩ ૬૬૬૫૮	
37	શ્રી કૃતિકા એ.શેડગે-૪૮૭૭૩	કલાક્-III	૭-૫૦૨, નીલ કંદ રેસીડન્સી, રાજવર્દની સામે, ન્યૂ એલ.પી.સવાણી સ્કુલ રોડ, પાલનપુર કેનાલ રોડ, જાકતનાકા, સુરત. મો. ૯૮૨૪૭ ૮૮૦૩૨	
38	શ્રી તોરલબહેન એ.પટેલ- ૪૮૯૨૮	કલાક્-III	૨૦૩, નેતિક રેસીડન્સી, એલ.પી.સવાણી ચાર રસ્તા પાસે, હનીપાર્ક રોડ, સુરત. મો. ૬૩૫૫૨ ૧૪૫૮૨	
39	શ્રી અંકિતા વી. શાહ-૪૮૨૦૬	કલાક્-III	૮૦૧, નવપદ એપાર્ટ., આશુતોષ હોસ્પિન્સી સામે, સગરામપુરા, મજુરાગેટ, સુરત.-૪૭૫૦૦૨ મો. ૯૪૨૭૫ ૭૬૪૭૨	

40	શ્રી દીપાબેન એમ.નાઈ-૪૯૨૨૨	કલાક-III	૧૫૦, જલારામ સોસા.-૩, મોડેલ ટાઉન પાસે, પરવત પાટીયા, સુરત - ૩૭૫૦૧૦ મો.૮૫૭૭૬ ૭૮૮૫૧	
41	શ્રી મહુરકુમાર એન.પટેલ- ૪૯૩૦૩	કલાક-III	૨૦૭, માધવબાગ સોસાયટી, રાજહારમોની ની બાજુમાં, ઉગત કેનાલ રોડ, સુરત.- ૩૭૫૦૦૫ મો.૮૭૫૮૪૦૧૦૮૮	
42	શ્રી સુનિલ એસ.સપકાળ-૧૨૦૨૮	પટાવાળા	૮૭, કૃષ્ણનગર સોસાયટી, જુનો કોસાડ રોડ, અમરોલી, સુરત મો.૮૮૭૭૫૪ ૭૧૬૪૫	
43	શ્રી કમલેશ બી.જાદવ-૧૨૬૩૧	પટાવાળા	૩૦૩, ત્રીજોમાળ મ્યુ.સ્ટાફ ક્વાર્ટર્સ ક્ષેત્રપાલ આરોગ્ય કેન્દ્ર, સગરામપુરા, સુરત. મો.૮૪૨૬૦ ૧૩૫૩૧	
44	શ્રી અમૃત એન.પટેલ-૧૩૮૩૫	પટાવાળા	મહાદેવનગર-૪, પ્લોટ નં. એ/૩૧ ઉધના, નવાગામ ડીડોલી, સુરત મો.૮૮૭૪૨ ૧૭૬૩૫	
45	શ્રી કમલેશકુમાર.એન.પાવાગઠી -૧૩૮૫૬	પટાવાળા	૪૧, વિજયનગર સોસા. પ્રભુનગરની બાજુમાં, કતારગામ દરવાજા, સુરત મો.૮૮૧૩૬ ૫૮૪૪૫	
46	શ્રી શંકર જી રાઠોડ-૧૩૮૫૮	પટાવાળા	મુ.પો. સોસક, તા. ઓલપાડ, જિ. સુરત. મો.૮૮૭૭૫ ૫૪૪૦૭	
47	શ્રી હરીશચંદ્ર બી.પટેલ-૧૩૮૦૧	પટાવાળા	બી-૨૨ પ્રભુ દર્શન સોસા, ઉગત નહેર, મોરાભાગળ ચાર રસ્તા ઉગત ગામ સુરત. ૩૮૫૦૦૫ મો.૮૮૨૮૮ ૦૮૫૮૬	
48	શ્રી શંશીકાંત એમ પટેલ- ૧૪૪૧૩	પટાવાળા	મુ.પો.સોસક, (નવુ ફણિય) તા. ઓલપાડ, જિ. સુરત-૩૮૫૦૪૦, મો.૮૮૮૬૧ ૩૪૧૮૧	
49	શ્રી સુર્યકાંત.જી. મોરે-૧૭૫૮૬	પટાવાળા	સી/૧૩, પુષ્પવાટિકા સોસા., વિદ્યાંકુંજ સ્કુલ પાસે, નુતન રો હાઉસની પાછળ, પાલ, સુરત. મો.૮૭૨૭૬ ૮૦૫૨૦	
50	શ્રી રહીમભાઈ.વાય.ઘોરી- ૧૭૭૪૪	પટાવાળા	એ-૧૦૩, પ્રથમ માળ, ગુલશને એડૂસ, સૈયદપુરા, નવી ચાલ, સુરત , મો..૮૮૨૮૩ ૭૩૮૭૮	
51	શ્રી ચેતન એસ.દરજી-૩૮૨૮૮	પટાવાળા	૪૫, કૃષ્ણકૃપા સોસાયટી, અસ. પી. કુકડીયા સ્કુલની બાજુમાં, પરવતગામ, ગોડાદરા રોડ, સુરત, મો.૮૮૦૯૧ ૪૪૮૦૦	
52	શ્રી હરીશકુમાર એન.પારધી -૩૮૩૩૧	પટાવાળા	બી/૧૩, મધુવન સોસા., ગુલાબવાડીની પાછળ, ડભોલી રોડ, સુરત. મો.૮૮૨૪૭ ૫૪૮૬૭	
53	શ્રી વિશાલ એચ પટેલ-૩૮૩૩૩	પટાવાળા	ડી/૧૩૮, વિદ્યાંકુંજ સોસાયટી, હિરાબાગ વરાધા રોડ, સુરત મો.૮૮૨૪૦ ૩૧૩૬૧	
54	શ્રી વિરાફ એ.દહેણુગરા- ૩૮૪૩૮	પટાવાળા	બી/૬-૫૦૨, સંસ્કાર રેસીન્સી, ન્યુ ક્રોસ રોડ, ઓપ-તો સુર્યાંજલી એપાર્ટમેન્ટ, અમરોલી, સુરત, મો.૮૮૭૭૫ ૫૨૫૪૧, ૮૬૬૪૮ ૩૦૪૨૩	
55	શ્રી મહુર જી.પટેલ-૩૮૮૮૮	પટાવાળા	ફાઈલ સ્ટાર મહોલો, પટેલ સ્ટ્રીટ, મગદલા, તા. ચોરાંસી, જી. સુરત. મો.૮૫૫૮૫ ૦૬૬૦૪, ૯૭૧૨૦ ૮૦૧૪૪	
56	શ્રી મહેન્દ્ર આર.સોલંકી-૪૦૧૮૩	પટાવાળા	૨૪૮, આશાપુરી સોસા. વિ-૨, પાડેસરા, સુરત-૩૮૪૨૨૦, મો.૮૫૮૬૦ ૩૮૨૧૫	
57	શ્રી રોબિન્સન આર.કિશ્ચિયન-૪૦૧૮૪	પટાવાળા	જી ૬ કિશ્ચિયન પાર્ક, મિશન હાઉસ, મુગલીસરા સુરત મો.૮૮૨૪૮ ૮૪૨૮૧	
58	શ્રી અમિત એમ.સાંરગ-૪૦૪૬૩	પટાવાળા	જી-૧૭, માધવ નગર, ભીમપોર, પો. દુમસ, મો.૮૦૩૩૫ ૬૮૦૧૫	
59	શ્રી પ્રિતમ.પી.સુરતી-૪૧૦૮૮	પટાવાળા	૩૦૪-શીવકૃપા સોસાયટી, નીલગીરી રોડ, ગોડાદરા, સુરત. મો.૭૫૬૭૭ ૭૦૪૭૪	
60	શ્રી સુજય એસ.ડે-૪૨૧૮૮	પટાવાળા	૧૧/૨૦૩, સુડા આવાસ, એલ. પી. સવાણી નજીક, પાલ રોડ, સુરત, મો. ૮૧૪૧૨ ૪૧૪૩૭	
61	શ્રી સચીન બી.સોલંકી-૪૨૩૪૨	પટાવાળા	પ્લોટ નં.૦૮, બુધ સોસાયટી, રેલ્વે લાઈફ્રેની પાછળ, ઉધના યાર્ડ, સુરત, મો. ૮૫૫૮૮ ૭૬૩૫૭	

62	શ્રી નિમેષ જે. ભગત-૪૩૦૪૬	પટાવાળા	ઈ-૨૦૨ ભૂમિ કોમ્પલેક્શ પ્રગતિ મંડળ વાડી , અયોધ્યા નગરી પાસે હનીર્પાક રોડ સુરત. મો.૮૪૬૦૮ ૩૭૩૮૫	
63	શ્રી પ્રજોશ જે.પટેલ-૪૪૫૫૭	પટાવાળા	નિશાળ ફળિયું, નાનાવાધાઈયા, છીત્રાપારડી,તા.:–પારડી,જી.:–વલસાડ મો.૮૭૨૭૪ ૮૨૭૮૪	
64	શ્રી જ્યેશ પી.વાધેલા-૪૫૫૦૧	પટાવાળા	બી-૧૦૮, પ્રભુનગર-૧, કતારગામ રોડ, સુરત મો.૮૮૧૩૩ ૭૭૪૭૬	
65	શ્રી કેતન જે.સોલંકી- ૪૫૭૨૨	પટાવાળા	૬૩- અભિષેક ટાઉનશીપ વિભાગ – ૨ નવો કોસાડ રોડ, અમરોલી સુરત મો.૭૪૦૫૭ ૨૨૬૫૦	
66	શ્રી અનિલ એ.નેરકર – ૪૫૭૨૩	પટાવાળા	એ-૮૦૧,સુમન સેલ,વાઈટ લોટસ સ્કુલની બાજુમાં,વેસુ, સુરત ૩૮૫૦૦૧, મો.૮૦૩૧ ૧૦૧૮૫	
67	શ્રી રાજેશભાઈ આઈ.પટેલ- ૪૮૧૮૭	પટાવાળા	એલ/૫-૬,પટેલ નગર સોસા.,પોલીસ સ્ટેશન ની સામે,જહાંગીરપુરા,સુરત. મો.૮૮૧૩૧ ૩૮૮૩૧	
68	શ્રી આશિષકુમાર એ.ગામીત- ૪૮૨૮૭	પટાવાળા	મુ.પો. વાડીબેસરોડ પારસી ફળીયુ, તા.સોનગઢ, જિ.તાપી- ૩૦૪૬૭૦, મો.૮૮૧૩૧ ૨૧૧૪૦	
69	શ્રી મધૂર ડી. અટોદ્રીયા- ૪૮૨૮૮	પટાવાળા	મુ.પો.સોડગામ, ગર્વસ હોસ્પિટલની સામે, સોડગામ, તા.વાલીયા જિ.ભરૂચ.- ૩૮૩૧૫૪, મો.૮૫૬૫૬ ૪૦૮૦૩	
70	શ્રી દિપકુમાર એચ.પડાયા- ૪૮૬૮૭	પટાવાળા	૧૧/૨૨૩૧, કોણીવાડ, વરીયાવી બજાર,સુરત. મો.૮૭૫૮૮ ૬૨૫૬૦	
71	શ્રી વૃષાંકુમાર એ.કોઠારી- ૪૮૭૨૭	પટાવાળા	૫/૮૫, ખાંડાકુવા સ્ટ્રીટ,ફાયર સ્ટેશનની પાસે, મોરાભાગળ,રાંદેર રોડ,સુરત મો.૮૨૬૫૫૬ ૭૮૩૨૧	
72	શ્રી ઉમેશ એ.અવચાર- ૪૮૨૪૮	પટાવાળા	૪૦૨, રાજીવીર કોમ્પલેક્શ,લેપડીયા શેરી,સૈયદપુરાસુરત. મો.૮૮૨૪૧ ૬૮૫૨૭	
73	શ્રી કેલાસબેન વી. પટેલ- ૪૮૨૬૮	પટાવાળા	સી - ૨૦૧, ટાઈમ ગેલેક્શી, રીમાર્ટ પાસે,જહાંગીરાબાદ,કેનાલ રોડ, સુરત. ૩૮૦૦૦૫. મો.૮૬૦૧૨ ૭૭૩૮૫	
74	શ્રી નરેશભાઈ ડી.ગીલાતર-૪૮૩૦૨	પટાવાળા	૧૩૪૭-ગાયત્રી નગર, છાપરાભાડ રોડ,અમરોલી,સુરત.-૩૮૫૦૦૪ મો.૮૬૬૪૬ ૧૮૭૨૮	
75	શ્રી ભાવેશ અરવિંદભાઈ પટેલ- ૪૮૬૮૭	પટાવાળા	૧૪૧, હિંદાયત નગર સોસા.,પાલનપુર, જાકતનાકા, રાંદેર રોડ, સુરત. મો.- ૮૧૪૧૫ ૨૫૫૪૦	
76	શ્રી હિરેનકુમાર ઉમેદભાઈ પટેલ- ૪૮૬૮૮	પટાવાળા	૨૦૨, મુ.પો.ભટલાઈ,ગોળી ફળિયા,તળાવ મહોલ્લો હજીરા, સુરત. મો.૮૮૮૮૮૮ ૭૦૫૧૬	
77	શ્રી ચેતનકુમાર મનોજભાઈ પટેલ- ૬૩૦૨૬	પટાવાળા	૩૭૯, મહાદેવ નગર-૧, ડીડોલી, ઉધના , સુરત. મો.૭૦૪૬૬ ૮૮૬૧૩	
78	શ્રી વિનય ચંદ્રકાંત રણપિસે- ૬૩૦૨૭	પટાવાળા	એ-૨૦૫,સ્વસ્થિતક પાર્ક એપાર્ટ.ભૂમિ કોમ્પલેક્શ એપાર્ટ.ની સામે,અયોધ્યા નગરી રોડ, સુરત. ૭૦૧૬૬ ૧૬૪૪૬	
79	શ્રી ધ્રુવકુમાર દેવજીભાઈ પટેલ - ૭૪૧૨૮	તા.પટાવાળા	એફ-૧૩,અભિનંદન એપા.., અસ્થાન,બારડોલી,સુરત – ૩૮૪૦૦૧,મો.૫૩૫૨૩ ૫૩૫૧૮	
80	શ્રી જૈમિન નરેન્દ્રભાઈ સેલર -૭૫૦૨૧	તા.પટાવાળા	ઘર નં-૬, સંજ્ય સોસાયટી, રાંદેર, સુરત-૩૮૫૦૦૫ મો.-૮૬૦૧૫૦૫૪૧૦	
81	શ્રી રચિત મહેશભાઈ સોલંકી-૭૫૪૭૭	તા.પટાવાળા	૨૧૩, સોમનાથ સોસા. આઝાદ નગર ની બાજુમાં ભટાર,અલથાન,સુરત-૩૮૫૦૧૭, મો.-૭૮૭૪૦૪૪૩૬૦	
82	શ્રી નિતીન ડી. સોલંકી -૭૫૫૫૭	તા.પટાવાળા	ઘર નં. ૨૮, સંજ્યનગર સોસાયટી, જહાંગીરપુરા, મોરાભાગળ, સુરત-૩૮૫૦૦૫ મો.-૮૬૬૨૦૪૬૩૪૫	
83	શ્રી ચંદ્રકાંત એલ. તાંદલેકર- ૧૮૩૨૬	બેલદાર	રૂમ નં. ૫, એસ.એમ.સી. કવાટસ, નગોરીવાડ, સૈયદપુરા, સુરત-૩૮૫૦૦૩ મો-૮૫૧૧૧૬૫૩૫૧	

84	શ્રીમતી રમીલાબેન કે. ગમાર- ૩૪૭૯૦	બેલદાર	સી - ૨૦૨, ટાઈમ ગેલેક્ષી, ડીમાર્ટ પાસે, જહાંગીરાબાદ, કેનાલ રોડ, સુરત. ૩૬૦૦૦૫ મો. ૮૧૪૧૯ ૬૩૪૫૫	
85	શ્રી સુનિલ એચ. પટેલ- ૩૫૪૮૮	બેલદાર	૫/૧૪૭૧, હરીપુરા, હરીજનવાસ, મેઈનરોડ, સુરત મો. ૮૮૦૮૬ ૪૮૬૨૮, ૮૮૦૮૬ ૪૮૬૩૪	
86	શ્રી હરેશ એમ. પટેલ- ૩૫૭૪૨	બેલદાર	૧૨૩, સુભાષનગર સોસાયટી, તુંભાલ ટાન્સપોર્ટ ગોડાઉન પાછળ, પૂણાગામ રોડ, સુરત મો. ૮૪૨૬૮ ૭૩૮૮૨, ૮૬૩૮૬ ૪૮૬૬૬	
87	શ્રી દિનેશ એ. ગીલાતર- ૩૬૮૫૧	બેલદાર	૨/૩૭૬૦, ઠખુવાળાની ગલી, નવસારી બજાર, સગરામપુરા સુરત. મો. ૮૪૬૬૫૦૮૪૮૪	
88	શ્રી ધર્મેશ ડી. પટેલ- ૪૧૦૮૮	બેલદાર	૩૦૨, શ્રી નાથજી કોમ્પલેક્શ, શ્રી રામ કોલોની, ડમોલી રોડ, સુરત. મો. ૮૮૮૮૫૭૯૧૧૧, ૭૮૮૦૦૭૪૦૪૧	
89	શ્રી તેજશ એમ. પટેલ- ૪૧૬૮૪	બેલદાર	મુ. મલગામા, પો. બેસાણ, તા. ચોર્યાસી, જી. સુરત, મો. ૮૪૨૭૧ ૩૭૭૧૨	
90	શ્રી નર્સિમ્બાઈ. એ. મીરજા- ૪૨૭૮૬	બેલદાર	૧૦, બંભોરા, પોસ્ટ. પીપોદરા, તા. માંગરોળ, જી. સુરત, મો. ૮૫૭૪૧૬૫૦૮૮	
91	શ્રી હર્ષકુમાર પી. કંથારીયા- ૪૮૩૪૦	બેલદાર	૧૨/૨૨૧૬, સૈયદપુરા, એડૂસની ચાલ, પ્રણામી મંદિર પાસે, સુરત. મો. ૭૮૮૦૮ ૩૫૨૭૦	
92	શ્રી નિતિન અમરતભાઈ દાશડા- ૪૮૬૮૬	બેલદાર	૮૦૮, બ્લોક નં.-એ, સુમન દર્શન એપાર્ટ, ડી. માર્ટ ની પાછળ, સીગાણપોર, સુરત મો. ૮૫૩૭૫ ૩૮૮૩૧	
93	શ્રી ઈતિશા નવીનચંદ્ર કોઠારી- ૬૩૧૬૨	બેલદાર	૭/૨૭૭૦, ન્રીજો માળ, ફ્લેટ નં. ૩૦૫, શ્રી કિઝા કોમ્પ., વાવશેરી, સૈયદપુરા, સુરત-૩૮૫૦૦૩ મો. ૮૫૩૭૨ ૬૨૧૫૮	
94	શ્રી સ્વાનિલ સી. તાંડલેકર - ૭૩૭૮૬	તા. બેલદાર	૩૮ નં. ૫, એસ. એમ. સી. સ્ટાફ કવાટર્સ, નાગોરીવાડ, સૈયદપુરા સુરત. મો. - ૭૬૮૮૧ ૧૫૪૩૪	

કુમલેઈન મેનેજમેન્ટ એન્ડ ઓનાલીસીસ સેલમાં ફરજ બજાવતા કર્મચારીઓની વિગત ૨૦૨૨-૨૩

અ.નં.	અધિકારી/કર્મચારીનું નામ	કર્મચારી નંબર	હોંડો	સરનામું	મો.ન.
1	શ્રીમતી હેમાંગીની પી. ઠાકોર	૧૦૮૧૨	ઓ.એ.સ.	એ-૨૦૩, આકાશ હોમ્સ, ભાગ્યલક્ષ્મી સોસાયટીની સામે, પીપલોં, સુરત-૭	૮૮૨૫૨૪૦૩૧૪
2	શ્રીકેતન. બી. શુક્લ	૧૨૪૫૫	પ્રથમ શ્રેણી કલાર્ક	૬, વંદના સોસાયટી, સરદાર બીજ સામે, અડાજાં રોડ, સુરત.	૮૮૨૫૦૩૮૦૩૮
3	શ્રી કિરીટકુમાર આર. ચૌહાણ	૧૨૫૮૫	પ્રથમ શ્રેણી કલાર્ક	એ-૫૦૧-૫૦૨, પારીજાત એપાર્ટ. મિનાક્ષી વાડી, ખોડીયાર માતા ના મંદિર પાસે, કઠારગામ, સુરત.	૮૪૨૭૧૬૮૧૫૮
4	શ્રી નિકિતા આર. પટેલ	૪૮૦૬૦	ત્રીજી શ્રેણી કલાર્ક	નગર શેઠની વાડી, મોરા ભાગળ ચાર રસ્તા, સુરત-૮	૮૨૩૮૮૦૬૪૬૪
5	શ્રી અંજના એ. પટેલ	૪૮૦૬૧	ત્રીજી શ્રેણી કલાર્ક	એ-૪૦, ન્યૂ સૈરબ સોસાયટી, એચ.પી પેટ્રોલીયમની સામે, મોરાભાગળ, સુરત.	૮૭૨૫૨૭૩૭૮૫
6	શ્રી હાર્ટિક એસ. ભર્ટ	૪૮૦૬૨	ત્રીજી શ્રેણી કલાર્ક	એફ-૪૦૩, રાજહંસ રેસીન્સી, સુભાપ ગાઈન પાસે, જહાંગીરપુરા, સુરત.	૮૫૫૮૮૦૬૭૧૩
7	શ્રી સનિલ અન. કાનફટે	૪૮૦૬૩	ત્રીજી શ્રેણી કલાર્ક	૫૮૦, જલારામ નગર, ગુજરાત હાઉસીંગ બોર્ડ, ગણેશપુરા, અમરોલી, સુરત.	૮૧૪૧૬૩૬૩૫૫
8	શ્રી જ્યેશ એમ. મકવાળા	૪૮૦૬૪	ત્રીજી શ્રેણી કલાર્ક	એ-૬, સસ્વતી સોસાયટી ગેટ નં. ૧, શારદા સ્કુલની સામે, કોઝ વે સીગણપોર રોડ, સુરત.	૮૪૨૬૦૩૨૩૬૪
9	શ્રી ત્રિકમલાઈ ડી.ચારણીયા	૩૫૭૫૨	બેલદાર	૫, પ્રાણનાથ સોસાયટી, વેડ રોડ, સુરત-૪	૮૮૧૩૩૭૩૦૭૭
10	શ્રી ચિરાગ એમ.પટેલ	૪૫૨૦૮	પટાવાળા	મુ.પો.તલાવરી ફળીયુ., નરોડ, મરોલી, જી.નવસારી	૮૭૨૭૪૮૮૧૮૧

કલમ-૪(૧) (બી) (૩) : દેખરેખ અને જવાબદારીના માધ્યમ સહિત
નિર્ણય લેવાની પ્રક્રિયામાં અનુસરવાની કાર્યરીતિ : -

- જાહેર સત્તા મંડળ સાથે સંયુક્ત છે.

કલમ—૪(૧) (બી) (૪) મધ્યસ્થ કચેરી ધ્વારા કરવામાં આવતા કાર્યો

મધ્યસ્થ કચેરીમાં કરવામાં આવતી કામગીરી :—

- (૧) સુરત શહેરની જનતા તરફથી આપવામાં આવતી અરજીઓ / ફરીયાદો, સરકારી, અર્ધસરકારી, અન્ય સંસ્થા તથા જાહેર જનતા તરફથી મે.કમિશનરશ્રીને તથા વિભાગીય વડાશ્રીને ઉદ્દેશીને આપવામાં આવતી અરજીઓ રૂબરૂ, કુરીયર, પોસ્ટ ધ્વારા આવતી અરજીઓ અતે સ્વીકારી જે તે ખાતા / ઝોનને આગળની કાર્યવાહી અર્થે મોકલવામાં આવે છે. ૬ ઝોન તથા મ.ધ.હોસ્પિ., સ્મીમેર હોસ્પિ. સ્લમ અપગ્રેડેશન સેલ, ફેનેજ, ટ્રાફિક સેલ ખાતેથી આવતી ટપાલો લાગત ખાતા / ઝોનને મોકલવામાં કામગીરી, તેમજ વિવિધ ખાતા / ઝોન તરફથી મે.કમિશનરશ્રીની સહી માટે રજુ કરવામાં આવતી ફાઈલો મે.કમિશનરશ્રી સમક્ષ રજુ કરી સહી થઈને આવેલ ફાઈલો જે તે ખાતા / ઝોનને મોકલવા અંગેની કામગીરી કરવામાં આવે છે.
- (૨) સામાન્ય સભા તથા સ્થાયી સમિતિમાં સભ્યશ્રીઓ તરફથી પુછવામાં આવતા પ્રશ્નો / સુચનો અંગે સંબંધિત ખાતામાંથી જવાબ મેળવી ફાઈલ તૈયાર કરવાની કામગીરી તેમજ સામાન્ય સભા, સ્થાયી સમિતિ તથા કમિશનરશ્રી તરફથી હેલ્પ એન્ક એન્જી., અંગે લેવામાં આવતી મીટિંગ તથા અન્ય મીટિંગોની કાર્યવાહીની નોંધ તૈયાર કરવાની કામગીરી કરવામાં આવે છે.
- (૩) સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓના બાળકોને ટયુશન ફી ચૂકવવા અંગેની કામગીરી, ૨૬ મી જાન્યુઆરી અને ૧૫ ઓગષ્ટ સમારંભ અંગેની કામગીરી, ચોમાસાની ઋતુ શરૂ થાય તે પહેલાં મધ્યસ્થ ફલડ કંટ્રોલ રૂમ શરૂ કરવાની તેમજ પ્રિ-મોન્સુન મેનેજમેન્ટ કરવાની કામગીરી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ પ્રિપેર્નેશા પ્લાનની પુસ્તિકા તૈયાર કરવાની કામગીરી, સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ / અધિકારીઓને વિવિધ સ્કોલરશીપ એનાયત કરવાની કામગીરી કરવામાં આવે છે.
- (૪) સરકારશ્રીમાં નાગરિક અધિકાર પત્રની દરમાસે મોકલવાની કામગીરી તથા સરકારશ્રી ધ્વારા વખતોવખત માંગવામાં આવતી કામગીરી અંગે વિવિધ ખાતાઓની માહિતીનું સંકલન કરી માહિતી મોકલવાની કામગીરી તથા સરકારશ્રી સાથે પત્ર વ્યવહાર કરવાની કામગીરી કરવામાં આવે છે.
- (૫) જુદા જુદા ખાતાઓ ધ્વારા કરવામાં આવતી દરખાસ્તો જે તે સમિતિવાઈઝમાં રજુ કરવા માટે સેકેટરીશ્રીને મોકલવાની કામગીરી કરવામાં આવે છે તેમજ સેકેટરીશ્રી તરફથી મોકલવામાં આવતા જુદી જુદી સમિતિના ઠરાવો લાગત ખાતા / ઝોનને મોકલવાની કામગીરી કરવામાં આવે છે.
- (૬) મેયરશ્રી, ડે.મેયરશ્રી, સ્થાયી સમિતિના અધ્યક્ષશ્રી, ઓડીટરશ્રીના પત્રો, કોર્ટ સમન્સ, વિભાગીય વડાશ્રીઓ સમક્ષ રજુ કરી જે તે ખાતા / ઝોનને આગળની કાર્યવાહી અર્થે મોકલવા અંગેની કામગીરી કરવામાં આવે છે.
- (૭) મ્યુ.સભ્યશ્રીઓ તરફથી આવતા ફરીયાદો તથા અનુદાન અંગેના પત્રો જે તે વિભાગીય વડાશ્રીઓ સમક્ષ રજુ કરી લાગત ખાતા / ઝોનને મોકલવા અંગેની કામગીરી કરવામાં આવે છે.
- (૮) ધી. બી.પી.એમ.સી. એકટ ૧૯૪૮ ની કલમ—૭૩(ફિ) અન્વયે રૂ.૧૦૦૦/- થી વધુના થયેલ / થનાર ખર્ચની જાણ કરવા તથા સદરહું અધિનિયમના અનુસુચિ—અ ના પ્રકરણ—૫ ના નિયમ—૨(૨) ના પ્રોવાઈઝો અનુસાર ટેન્કર ન મંગાવવાની થયેલ અનિયમિતતા કોન્ડોન કરવા અંગે સુરત મહાનગરપાલિકાની વિવિધ સમિતિમાં જાણ કરવા અંગેની કામગીરી કરવામાં આવે છે.

કલમ-૪(૧) (બી) (૪) મધ્યસ્થ કચેરી હેઠળ કાર્યરત કમ્પ્લેઇન મેનેજમેન્ટ ધ્વારા કરવામાં આવતા કાર્યો

કમ્પ્લેઇન મેનેજમેન્ટ એન્ડ એનાલીસીસ સેલ ધ્વારા કરવામાં આવતી કામગીરી : -

- (૧) સુરત શહેરની જનતા તરફથી કોલ સેન્ટર/હેલ્પલાઈન, વોટ્સ એપ, મોબાઇલ એપ્લિકેશન તેમજ વેબ સાઈટ મારફત કરવામાં આવતી મહાનગર પાલિકા સંબંધિત રજુઆતો/ ફરીયાદો, સ્ટેન્ડીંગ કમિટી, સામાન્ય સભા સરકારના વિવિધ પોર્ટલો મારફત કરવામાં આવતી ફરીયાદો/રજુઆતો કમ્પ્લેઇન મેનેજમેન્ટ સીસ્ટમમાં નોંધીને સંબંધિત અધિકારી/એસાઈની ઓફિસરને કેટેગરી સબ કેટેગરી પ્રમાણે નોંધીને અરજદાર/ફરીયાદને તેમજ સંબંધિત અધિકારી/ફરીયાદીને કમ્પ્લેઇન આઈ.ડી.નંબર, ફરીયાદની વિગત અને એસાઈની ઓફિસરો મોબાઇલ નંબર ની સીસ્ટમ થી SMS મારફત મોકલવાની કામગીરી.
- (૨) સામાન્ય સભા તથા સ્થાયી સમિતિમાં સભ્યશ્રીઓ તરફથી પુછવામાં આવતા પ્રશ્નો / સુચનો અંગે લેવામાં આવતી મીટિંગ તથા અન્ય મીટિંગોની કાર્યવાહીની નોંધ કમ્પ્લેઇન મેનેજમેન્ટ સીસ્ટમમાં દાખલ કરવાની કામગીરી કરવામાં આવે છે.
- (૩) જુદી જુદી કમ્પ્લેઇન કેટેગરી અને સબ કેટેગરી મુજબ નકકી કરેલ સમય મર્યાદામાં ઓફિસરો/એસાઈની ઓફિસરો મારફત પેન્ડીંગ કમ્પ્લેઇનનો નિકાલ કરવા માટે વખતો વખત ટેલીફોનથી સંપર્ક, કમ્પ્લેઇન અંગે જરૂરીયા પ્રમાણે જુદા જુદા તબક્કે નોંધ ઈચ્ચુ કરવાની કામગીરી.
- (૪) વરસાદની સિજન દરમ્યાન ફલક કંટ્રોલ તરફથી પુરી પાડવામાં આવતી ઉકાઈ લેવલ, શહેરનો વરસાદ, કોઝ વે લેવલ, કોઝ વે સ્ટેટ્સની માહિતી રેઇનફોલ સીસ્ટમમાં ઇનપુટ કરવાની તેમજ શહેરના વરસાદના ઝોન વાઈઝ આંકડા, ઉકાઈ લેવલના, તેમજ શહેરની આજુબાજુના ગામડાઓના વરસાદની વિગતની કોમ્પ્યુટરમાં નોંધ કરવાની કામગીરી.

કલમ—૪(૧)(બી)(૫) પોતાના કાર્યો બજાવવા માટે પોતાની પાસે અથવા નિયંત્રણ હેઠળના અથવા પોતાના કર્મચારીઓની ધ્વારા ઉપયોગમાં લેવાતાં નિયમો, વિનિમયો, સુચનાઓ, નિયમસંગ્રહો અને રેકર્ડ :—

- બી.પી.એમ.સી. એકટ—૧૯૪૮
- બી.સી.એસ.આર.નાણાંકીય તથા અન્ય નિયમો
- બી.સી.એસ.આર.
- પેન્શન(નિયમો)
- જી.સી.એસ.આર.—૨૦૦૨
- ખાતાકીય તપાસનાં નિયમો
- નોકરી સામાન્ય શરતોના નિયમો—૨૦૦૨
- ગુજરાત મુલકી સેવા (પેન્શન) નિયમો સને ૨૦૦૨ નો પરીચય
- ગુજરાત મુલકી સેવા (પગાર) નિયમો સને ૨૦૦૩ નો પરીચય
- ગુજરાત મુલકી સેવા (મુસાફરી ભથ્યું) નિયમો સને ૨૦૦૨ નો પરીચય
- બોમ્બે એકટ—૧૯૪૮
- ખાતાકીય તપાસ, ૯/૧૮/૨૭, નાણાંકીય, વતાળુંક, શિસ્ત, પગાર, ૨જા વિગેરેનાં નિયમો નો પરિચય ફક્ત ઠરાવો.
- જનરલ બોર્ડ, સ્થાયી બોર્ડનાં ઠરાવો
- કમિશનરશી તરફથી વખતોવખત બહાર પાડવામાં આવતાં પરીપત્રો, નોંધ વિ.
- ગુજરાત સરકાર તરફથી વખતોવખત બહાર પાડવામાં આવતાં હુકમો, ઠરાવો (જી.આર.) વિગેરે
- ભ્યુ. રૂલ્સ પાર્ટ-૧ અને પાર્ટ-૨

કલમ-૪ (૧) (બી)(૬) નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજાના વર્ગનું પત્રક .

– જાહેર સત્તા મંડળ સાથે સંયુક્ત છે.

એ	પરમીનન્ટ (કાયમી)	ડી.પી.ઓર્ડર ફાઈલ તમામ ખાતાવિકારી/વિભાગીયવકા તથા પોલીસી ફાઈલ
બી	૩૦થી ૩૫ વર્ષ	મહેકમને લગતા પેપર્સ
સી	૧૦ વર્ષ	પગાર રોલ ફાઈલ
ડી	૫ વર્ષ	નેતા શાસક પક્ષના પત્રોની નોંધ રજીસ્ટર, વિરોધ પક્ષના નેતાના પત્રોની નોંધ રજીસ્ટર, દંડકના પત્રોની નોંધ રજીસ્ટર, સીએઓઓ કચેરી હુકમ રજીસ્ટર, સીએડી રજીસ્ટર, સીએમએફ રજીસ્ટર, એમએસી રજીસ્ટર, એમએનસી રજીસ્ટર, સીસ્થાસ રજીસ્ટર, એસએનઆર રજીસ્ટર, ડી/રજીસ્ટર, જી –રજીસ્ટર, જી/૧/રજીસ્ટર, ડીએફ–રજીસ્ટર, સી–રજીસ્ટર, સીએન–રજીસ્ટર, સીએચ–રજીસ્ટર, સીક્યુરેટ્ઝન–રજીસ્ટર, એમરીએ–રજીસ્ટર, સ્થાયી સમિતિ દરાવ રજીસ્ટર, અન્ય સમિતિ દરાવ રજીસ્ટર, સ્થાયી સમિતિ દરખાસ્ત રજીસ્ટર, અન્ય સમિતિ દરખાસ્ત રજીસ્ટર, સામાન્ય સભા દરાવ રજીસ્ટર, બાઈન્ડર રજીસ્ટર, ઉત્તીર્ણ દરખાસ્ત રજીસ્ટર, ડીસીએ રજીસ્ટર, ડીસીએ ગ્રાન્ટ રજીસ્ટર, ફેન્કીંગ રજીસ્ટર(આરપીએડી/ સ્પીડપોસ્ટ, સાઈ), આરટીઆઈ અરજી રજીસ્ટર, અપીલ અરજી રજીસ્ટર, ઝોનબહારના ખાતાની ટપાલરજીસ્ટ તથા ઉપરોક્ત તમામ રજીસ્ટર બાબતેની ટપાલબુક, તેમજ બહારના ખાતામાં મોકલવામાં આવતી ટપાલ બુક વિ.ડી.એમ.પી./ઓડીટ અહેવાલ/વહીવટી અહેવાલ સને–૨૦૧૨–૧૩ થી ૨૦૧૬–૧૭
ઢ	૨ વર્ષ	—નીલ—

કલમ—૪ (૧) (બી)(૭) નિતિ ધડતરના અથવા તેના અમલીકરણના સબંધમાં જનતાના સત્યો સાથે વિચાર અને વિનિમય માટે અથવા તેમના ધ્વારા રજૂઆત માટેની વિધમાન કોઈ વ્યવસ્થાની વિગતો .

– જાહેર સત્તા મંડળ સાથે સંયુક્ત છે.

કલમ—૪ (૧) (બી)(૮) સલાહના હેતુઓ માટે બે અથવા તેથી વધુ વ્યક્તિઓના અનેલા બોર્ડ કાઉન્સીલો, સમિતિઓ વિ.

– જાહેર સત્તા મંડળ સાથે સંયુક્ત છે.

કલમ ૪(૧)(બી)(૮)મધ્યસ્થ કચેરી માં ફરજ બજાવતાં અધિકારી / કર્મચારીઓની વિગત

"બીસીએનટી વાઈજ અધિકારીઓ અને કર્મચારીઓની માહિતી www.suratmunicipal.gov.in પર સંયુક્ત રીતે મુકવામાં આવેલ છે તથા અત્રેના ખાતાના કર્મચારીઓના મહેકમ દફ્તર તથા પગાર રજીસ્ટરની નકલ ખાતામાં ઉપલબ્ધ છે."

કલમ. ૪ (૧) (બી) (૧૦) દરેક અધિકારી/ કર્મચારીઓને મળતા માસીક
મહેનતાણા :—

— બી.સી.એન.ટી વાઈડ અધિકારી અને કર્મચારીઓની માહિતી WWW.suratmunicipal.gov.in
પર સંયુક્ત રીતે મુકવામાં આવેલ છે. તથા અતેના ખાતાના કર્મચારીઓનાં મહેકમ દફ્તરે તથા પગાર
રજીસ્ટરની નકલ ખાતામાં ઉપલબ્ધ છે.

કલમ-૪(૧)(૧૦) અપીલ અધિકારી અને જાહેર માહિતી અધિકારી

(પી.આઈ.ઓ.)

વિનિયમોમાં જોગવાઈ કર્યા મુજબ મહેનતાણાંની પદ્ધતિ સહિત દરેક અધિકારી

અને કર્મચારીઓને મળતું માસિક મહેનતાણું

નિયમોનુસાર મળવાપાત્ર પગારધોરણ નક્કી કરવાની પ્રક્રિયા કેન્દ્ર / ગુજરાત સરકારશી તરફથી વખતોવખત

નક્કી કરવામાં આવતાં વેતન મુજબ

ક્રમ	અધિકારીનું નામ અને હોદ્દો	જુનું પગારધોરણ	હાલનું પગારધોરણ	ગ્રેડ પે
૧	શ્રી હેમાંગીની પી. ઠાકોર ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ અને અપીલ અધિકારી	રૂ.૬૫૦૦-૧૦૪૦૦	રૂ.૬૩૦૦ થી રૂ.૭૪૮૦૦ રૂ.૪૪૮૦૦ થી રૂ.૧૪૨૪૦૦	રૂ.૪૬૦૦.૦૦
૨	શ્રી ફાલગુનીભેન આર. મેહતા જાહેર માહિતી અધિકારી (મધ્યસ્થ કચેરી)	રૂ.૬૫૦૦-૧૦૪૦૦	રૂ.૬૩૦૦ થી રૂ.૭૪૮૦૦ રૂ.૪૪૮૦૦ થી રૂ.૧૪૨૪૦૦	રૂ.૪૬૦૦.૦૦
૩	શ્રી કેતન. બી. શુક્લ પ્રથમ શ્રેણી કલાર્ક અને જાહેર માહિતી અધિકારી (કમ્પ્લેઇન મેનેજમેન્ટ)	રૂ.૬૫૦૦-૧૦૪૦૦	રૂ.૬૩૦૦ થી રૂ.૭૪૮૦૦ રૂ.૪૪૮૦૦ થી રૂ.૧૪૨૪૦૦	રૂ.૪૬૦૦.૦૦

કલમ ૪ (૧) (બી) (૧૧) તમામ યોજનાઓ સૂચિત ખર્ચ ચૂકવેલ નાણા પરના
અહેવાલોની વિગતો દર્શાવત અંદાજપત્ર :—

– બી.સી.એન.ટી વાઈઝ અધિકારી અને કર્મચારીઓની માહિતી WWW.suratmunicipal.gov.in
પર સંયુક્ત રીતે મુકવામાં આવેલ છે.

**કલમ ૪(૧)(બી)(૧૨) ફાળવેલ રકમો સહિત સબ્સીડી કાર્યક્રમોની અમલ
બજવણીની રીત અને એવા કાર્યક્રમોના લાભાર્થીઓની વિગતો:-**

સને ૨૦૨૨-૨૩ માં આવેલ મેયર્સફંડ સહાય માટે ની અરજી

ક્રમ	અરજદારનું નામ	અરજદારનું સરનામું	અક્સમાતનો પ્રકાર	અક્સમાતની તારીખ	ચુકવવામાં આવેલ સહાયની તારીખ	સહાય વસ્તુનાં રૂપમાં અને રોકડ
						વાસણ સેટ રોકડ
૧.	પરેશભાઈ(પાર્થ) મહેશભાઈ મૈસુરીયા	જુંપડા નં.૪, ઉગતગામ, જહાંગીરાબાદ બેંસાણ રોડ,	ભારે પવનના કારણે જુંપડ પડવાથી	૨૨/૦૫/ ૨૦૨૨	૦૨/૧૧/ ૨૦૨૨	૦૧ ૫૦૦૦/-
૨.	રેવાબેન સોમાભાઈ રાઠોડ	બોમ્બે કોલોની, હજીરા મેઈનરોડ, ભાઈ	આગ લાગવાથી	૧૪/૧૧/૨૦૨૨	૨૬/૧૨/૨૦૨૨	૦૧ ૫૦૦૦/-
૩.	જયંતિભાઈ છોટુભાઈ રાઠોડ	બોમ્બે કોલોની, હજીરા મેઈનરોડ, ભાઈ	આગ લાગવાથી	૧૪/૧૧/૨૦૨૨	૨૬/૧૨/૨૦૨૨	૦૧ ૫૦૦૦/-
૪.	ટવિંકલબેન જયંતિભાઈ રાઠોડ	બોમ્બે કોલોની, હજીરા મેઈનરોડ, ભાઈ	આગ લાગવાથી	૧૪/૧૧/૨૦૨૨	૨૬/૧૨/૨૦૨૨	૦૧ ૫૦૦૦/-

કલમ. ૪(૧)(બી)(૧૩) છુટણાટ, પરવાનાઓ અથવા અધિકૃતિઓ
મેળવનારાઓની વિગત :—

—જાહેર સત્તા મંડળ સાથે સંયુક્ત છે. અતેની અલાયદી માહિતી નથી.

કલમ. ૪(૧)(બી)(૧૪) ઇલેક્ટ્રોનીક્સ સ્વરૂપમાં ઉપલબ્ધ માહિતીને લગતી વિગતો :—

—જાહેર સત્તા મંડળ સાથે સંયુક્ત છે. અતેની અલાયદી માહિતી નથી.

કલમ ૪(૧)(બી)(૧૫) જાહેર ઉપયોગ માટે નિભાવવામાં આવતાં હોય તેવા
ગ્રંથાત્મક વિ.

— જાહેર સત્તામંડળ સાથે સંયુક્ત છે.

કલમ. ૪(૧)(બી)(૧૬) જાહેર માહિતી અધિકારીઓનાં નામો, હોદ્દો, અને
બીજી વિગતો

જાહેર માહિતી અધિકારીઓનાં નામો, હોદ્દો અને બીજી વિગતો સુરત મહાનગરપાલીકાની
વેબસાઈટ www.suratmunicipal.gov.in પર નજીકના ટૂંકાળામાં ફેરફાર થયેલ હોય તે સિવાય મહદ અંશે
સંયુક્ત રીતે મુકવામાં આવેલ છે. અને તે પણ સમયાંતરે અધતન કરવામાં આવે છે. તથા ઝોન કચેરી/નાગરિક
સુવિધા કેન્દ્ર ખાતે બોર્ડ ઉપર પણ પ્રસિધ્ધ કરવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે.

કલમ નં. ૪(૧)(બી)(૧૭) ઠરાવવામાં આવે તેવી બીજી માહિતી :-

—સુરત મહાનગરપાલિકા જાહેર સત્તા મંડળ સાથે સંયુક્ત છે. અતેના ખાતાની અલાયદી માહિતી નથી.